

September 05, 2024

To,

BSE Limited National Stock Exchange of India Limited

Phiroze Jeejeebhoy Towers Exchange Plaza,

Dalal Street Bandra Kurla Complex, Mumbai- 400001 Bandra (E), Mumbai - 400 051

Scrip Code: 532967 Scrip ID: KIRIINDUS

Dear Sir/Madam,

Sub: Newspaper Publication of Notice of the 26th Annual General Meeting.

With reference to the above captioned subject and in compliance with Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, we submit herewith the copies of newspaper advertisements in respect of Notice of the 26th Annual General Meeting of the Company as published in Jai Hind – Ahmedabad edition (Gujarati) and Financial Express - Mumbai edition (English) on Thursday, September 05, 2024.

You are requested to kindly take note of the same.

Thanking you,

Yours faithfully,

For Kiri Industries Limited

Suresh Gondalia **Company Secretary** M. No.: F7306

Encl: As stated

CHEMICALS

FINANCIAL EXPRESS

Place: Ahmedabad

Kiri Industries Limited Fine Fell of Colores

ZENLABS ETHICA LIMITED Regd. Office: Plot No. 194-195, 3rd floor, Industrial area, Phase II, Ram Darbar, Chandigarh - 160002.

Tel: 0172-4651105, Email: queries@zenlabsethica.com CIN: L74900CH1993PLC033112 | Website: www.zenlabsethica.com

NOTICE TO SHAREHOLDERS

INFORMATION REGARDING 31ST ANNUAL GENERAL MEETING OF ZENLABS ETHICA LIMITED AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 31ST Annual General Meeting (AGM) of the company will be held on Monday, September 30th, 2024 at 11:30 AM IST at the registered office of the Company situated at Plot No. 194 -195, 3rd Floor, Industrial Area, Phase II, Ram Darbar, Chandigarh -160002, to transact the business, as set out in the Notice of AGM.

The Notice of the AGM along with Annual Report for the financial year 2023-24 will be sent only by electronic mode to all the shareholders whose e-mail addresses are registered with the Company/ Depositories in accordance with the MCA and SEBI Circulars. Members may note that Notice of the 31st AGM and Annual Report 2023-24 will also be available on the website of the Company at https://www.zenlabsethica.com and on the website of the stock exchange i.e., BSE Limited at www.bseindia.com and web sites of the Stock Exchanges i.e. BSE Limited instructions for and the manner of participation in remote evoting or casting vote through the e-voting system during the AGM will be provided in the Notice of the AGM.

We urge all the shareholders who have not registered their email addresses with the Company/ Depositories to do so forthwith in order to receive all communications promptly without any disruption. Updation of the correct email address in the records will help us to communicate with you effectively. The Members holding Equity Shares of the Company in Dematerialized Form and who have not registered their email addresses and mobile numbers with the Depositories through Depository Participant ('DP'), are requested to register their e-mail address, in respect of demat holdings with the respective Depository Participant (DP), by following the procedure prescribed by the Depository Participant and the Members holding shares in Physical Form are requested to update the KYC details in prescribed Form No ISR-1 and other relevant forms with Company's Registrar and Share Transfer Agent (RTA), M/s Bigshare Services Private Limited.

Further, as required by SEBI Circular dated March 16, 2023, a reminder was sent to shareholders holding shares in physical form to update their KYC details. The members may download the prescribed forms from the website of the RTA Bigshare Services Private Limited at www.bigshareonline.com.

For any guery on the above matter, shareholders of the company are requested to contact: M/s Bigshare Services Pvt. Ltd, Office No 56-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East) Mumbai - 400093 Tel No: 022 - 40430200 62638200 E-mail: info@bigshareonline.com.

Date: 05.09.2024 Place: Chandigarh For ZENLABS ETHICA LIMITED

Manju Bala Company Secretary & Compliance Officer



CAPITAL INDIA FINANCE LIMITED

Corporate Identity Number (CIN): L74899DL1994PLC128577 Regd. Office: 701, 7th Floor, Aggarwal Corporate Tower, Plot No. 23, District Centre, Rajendra Place, New Delhi - 110008, Ph. No.: 011-69146000 Corporate Office: Level - 20, Birla Aurora, Dr. Annie Besant Road, Worli, Mumbai - 400030, Ph. No.: 022-45036000

Website: www.capitalindia.com, Email: secretarial@capitalindia.com

NOTICE OF 30™ ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO-VISUAL MEANS (OAVM) AND INFORMATION ON E-VOTING

NOTICE is hereby given that:

- The 30th (Thirtieth) Annual General Meeting ("AGM") of the Members of Capital India Finance Limited ("Company") will be held on Thursday, September 26, 2024, at 11:00 A.M. (IST) through Video Conferencing/Other Audio Visual Means ("VC/OAVM") to transact the businesses as set out in the Notice of the AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & the rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), read with the applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI") for convening the general meetings through VC/OAVM. The deemed venue of the AGM shall be the Registered Office of the Company i.e. 701, 7th Floor, Aggarwal Corporate Tower, Plot No. 23, District Centre, Rajendra Place, New Delhi - 110008.
- Pursuant to the applicable circulars issued by MCA and SEBI, physical attendance of the Members is not required at the AGM, and attendance of the Members through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act and the facility for appointment of Proxies by Members will not be available. The Company has appointed KFin Technologies Limited ("KFintech" or "RTA") to provide facility for voting through remote e-voting, for participation in the AGM through VC/ OAVM facility and e-voting during the AGM. The manner and instructions to cast vote through remote e-voting / e-voting during the AGM have been provided in the notice of AGM.
- 5. The Notice of the AGM and the Annual Report for the Financial Year 2023-24 including therein the Audited Financial Statements for Financial Year 2023-24, Auditor's Reports, Board's Report, along with all the annexures have been sent by the Company on September 04, 2024, in Electronic Mode to all the members whose E-mail IDs are registered with the Company / RTA of the Company or with the respective Depositories of members. However, an option is available to the Members to continue to receive the physical copies of the documents/ Annual Report by making a specific request quoting their Folio No./Client ID & DP ID to Company or to RTA. These documents are also available on the website of the Company at www.capitalindia.com, RTA at www.kfintech.com and may also be accessed from the website of BSE Limited at www.bseindia.com, where the securities of the Company are listed.
- . In compliance with the provisions of Section 108 of the Act, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and in terms of applicable circulars issued in relation to e-voting facility, the Members are provided with the facility to cast their vote electronically, through the e-voting services provided by KFintech, on all the resolutions set forth in the notice of AGM.
- The remote e-voting period shall commence on Monday, September 23, 2024 at 09:00 A.M. (IST) and shall end on Wednesday, September 25, 2024 at 05:00 P.M. (IST). The said remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote is cast by a member, the same cannot be modified subsequently. A Member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again at the meeting.
- . The cut-off date for the purpose of ascertaining the eligibility of the Members to avail e-voting facility will be Friday, September 20, 2024. The voting rights of Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on the cut-off date, Members are eligible to cast vote through remote e-voting or e-voting during AGM, only if they are holding shares as on the cut-off date. Any person, who acquire shares of the Company and become its Member after dispatch of the notice of
- the AGM and holding shares as on the cut-off date i.e. Friday, September 20, 2024, are requested to refer to the notice of AGM for the process to be adopted for obtaining the login id and password for casting vote through remote e-voting, for participation in the AGM through VC/OAVM facility and e-voting during the AGM. A person who is not a member as on the cut-off date should treat the notice of AGM for information purpose only.
- Members attending the AGM who hold shares as on the cut-off date and who have not already cast their vote through remote e-voting and or otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system during the AGM.
- Members holding shares in physical mode are hereby notified that pursuant to the applicable SEBI circular(s), all holders of physical shares can update/ register their contact details including the details of e-mail ids by submitting the requisite Form ISR-1 along with the supporting documents. ISR 1 Form can be downloaded from the link:

https://capitalindia.com/uploads/UnpaidDividend/Form%20ISR-1.pdf Detailed FAQ can be found on the link: https://ris.kfintech.com/faq.html

- 10.Members holding shares in the dematerialized form are requested to register/update their e-mail addresses with their relevant DPs.
- 11. The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, September 21, 2024, to Thursday, September 26, 2024 (both days inclusive) for the purpose of holding the 30th (Thirtieth) AGM and for determining the names of Members eligible for final dividend on equity shares (@10% i.e. INR 0.10 per Equity Share of nominal value of INR 10 each) for the Financial Year ended on March 31, 2024, if declared at the AGM. The dividend will be payable to those Members whose names will appear in the Register of Members as on Friday, September 20, 2024 ("Record Date"). The dividend, subject to the approval of the Members, shall be paid within 30 days from the date of AGM.
- 12. The Members who wish to speak/raise questions during the meeting may register themselves as speaker for the AGM to express their views. They can visit https://emeetings.kfintech.com and login through the user id and password provided in the mail received from KFintech. On successful login, select 'Speaker Registration' option, which will open on September 23, 2024 (9:00 A.M. to 5:00 P.M.). Members registering themselves as a Speaker shall be provided a 'queue number' before the AGM. The Company reserves the right to restrict the speakers at the AGM to only those Members who have registered themselves, depending on the availability of time for the AGM.
- 13. Members may note that pursuant to the amendment in the Income Tax Act, 1961, dividend income will be taxable in the hands of the members and the Company is required to deduct tax at source (TDS) at the time of making the payment of dividend to members at the prescribed rates. A separate communication in this regard will be circulated to the members. 14.Mr. Arun Kumar Gupta (COP: 8003) of M/s Arun Gupta & Associates, Company Secretaries, has been
- appointed as the Scrutinizer to scrutinize the e-voting process (including the votes cast during AGM) in a fair and transparent manner, the results declared, along with the Scrutinizer's Report shall be placed on the Company's website at www.capitalindia.com, after the declaration of result by the Chairman or a person authorized by him. The results shall also be submitted to the Stock Exchange where the securities of the Company are listed.
- 15.In case of any query and/or grievance, in respect of voting by electronic means, Members may refer to the Help & Frequently Asked Questions (FAQs) and E-voting user manual available at the download section of https://evoting.kfintech.com (KFintech's Website) or contact Mr. Shiva Kumar, at evoting@kfintech.com or call KFintech's toll free No. 1-800-309-4001 for any further clarifications.

For Capital India Finance Limited

Place: New Delhi Sulabh Kaushal Date: September 04, 2024 Chief Compliance Officer & Company Secretary

(CIN-L24231GJ1998PLC034094)

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Townhall, Ellisbridge, Ahmedabad 380 006 Contact No: (P) +91 79 - 26574371/72/73, Fax: +91 79 - 26574374 Email Id: info@kiriindustries.com, Website: www.kiriindustries.com.

NOTICE OF THE 26th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 26th Annual General Meeting ("AGM") of the members of KIRI INDUSTRIES LIMITED ("the Company") is scheduled to be held on Friday, September 27, 2024 at 11.00 A.M. (IST) through Video Conferencing ("VC") to transact the businesses as set out in the notice of the AGM, in compliance with provisions of the Companies Act, 2013 ("the Act") and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021, 02/2022, 10/2022 and 09/2023 issued by Ministry of Corporate Affairs and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62, SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 and SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 issued by the Securities and Exchange Board of India ("SEBI") (Collectively, "the Circulars").

As per the above Circulars and Listing Regulations, the Notice of AGM along with the Annual report for the FY 2023-24 is sent on Wednesday, September 04, 2024, through electronic mode to the shareholders whose e-mail addresses are registered with the Company/Depositories as on Friday, August 30, 2024. The Annual Report for the FY 2023-24 along with Notice of 26th AGM is also available on website of the Company at www.kiriindustries.com, website of the stock exchanges at www.bseindia.com and www.nseindia.com and website of the Central Depository Services India Limited ("CDSL") at

Pursuant to the Section 91 of the Act read with the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, September 21, 2024 to Friday, September 27, 2024 (both days inclusive) for the purpose of the AGM and the cut-off date is Friday, September 20, 2024 for determining eligibility to vote through remote e-voting or e-voting during the

As per Section 108 of the Act read with rules made thereunder, the businesses will be transacted only through voting by electronic means. The remote e-voting, for the members holding shares as on cut-off date, will commence on Tuesday, September 24, 2024 at 9.00 A.M. (IST) and will end on Thursday, September 26, 2024 at 5.00 P.M. (IST). The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. The instructions for e-voting during AGM are provided in the Notice of AGM. Members exercising right to vote through remote e-voting may participate and attend the AGM but shall not be allowed to vote again during the AGM. Persons who have acquired shares and become shareholders after sending Notice and holds shares as on cut-off date, may cast their votes by obtaining the login details by sending request to helpdesk.evoting@cdslindia.com. Instructions for login method for e-voting and joining virtual meeting are provided in the M/s. RTBR & Associates, Practicing Company Secretaries, have been appointed as the Scrutinizer to scrutinize the e-voting

process in a fair and transparent manner. n case of queries or issues regarding e-voting, shareholders may refer to FAQs and e-voting manual available at www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Sr. Manager, CDSL, A Wing, 25th Floor, Marathon

Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai – 400013, E-mail: helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800 22 55 33. For Kiri Industries Limited Date: September 05, 2024 sd/-

Best Agrolife Limited

BEST AGROLIFE LIMITED

CIN:L74110DL1992PLC116773 Regd. & Corporate Office: B-4, Bhagwan Dass Nagar, East Punjabi Bagh, New Delhi-110026 Ph: 011-45803300 | Email: info@bestagrolife.com | Website: www.bestagrolife.com INFORMATION REGARDING 33RD ANNUAL GENERAL MEETING OF THE COMPANY

In compliance with the applicable provisions of the Companies Act, 2013 (the 'Act') and rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the General Circulars 2/2022 and 19/2021, other circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated Jan 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars"). the 33rd Annual General Meeting ('AGM') of the Members of BEST AGROLIFE LIMITED will be held on Monday, September 30, 2024 at 12:30 P.M. (IST) through Video Conferencing ('VC')/Other Audio Visual Means ('OAVM') to transact the businesses set forth in the Notice of AGM. Members attending the AGM through VC / OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

In accordance with the MCA Circulars and SEBI Circulars, the Notice of AGM and the Financial Statements for the Financial Year 2023-24 along with Reports of the Board of Directors and the Auditors and other documents required to be attached thereto (collectively referred as 'Annual Report') will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company/ Depository Participants (DPs). The instructions for joining and manner of participation in the AGM has been provided in the Notice of the AGM. Members, who are holding shares in physical/ electronic form and their e-mail addresses are not

registered with the Company/ their respective Depository Participants, are requested to register their e-mail addresses at the earliest by sending scanned copy of a duly signed letter by the Members mentioning their name, complete address, folio number, number of shares held with the Company along with self-attested scanned copy of the PAN Card and self-attested scanned copy of any one of the following documents viz. Aadhar Card, Driving Licence, Election Card, Passport, utility bill or any other Government document in support of the address proof of the Members as registered with the Company for receiving the Annual Report 2023-24 along with the AGM Notice by email to info@bestagrolife.com or info@skylinerta.com, Members holding shares in demat form can update their email address with their Depository Participants. The shareholders may also contact to the Company at our Corporate Office in case of any clarification to register their email id & mobile number.

Members holding shares in physical form who wish to avail NECS facility may authorize the Company with their NECS mandate in the prescribed form, which can be downloaded from the Company's website www.bestagrolife.com and the requests for payment of dividend through NECS should be sent latest by 23rd September, 2024 at info@bestagrolife.com and members holding shares in demat form who wish to avail NECS facility, may send mandate in the prescribed form to their respective Depository

The Company is providing remote e-voting facility to all its members to cast their votes on the resolutions set out in the Notice of the AGM. Additionally, the Company is also providing the facility of voting through e-voting system during the AGM. Detailed procedure for casting votes through remote e-voting/ e-voting has been provided in the Notice of the AGM.

The Company has fixed the record date September 23, 2024 for the purpose of determining the member entitled for receiving dividend for the Financial Year 2023-24 and the said notice is also available on the website of the company at www.bestagrolife.com

The Notice of the AGM along with Annual Report will be placed on the website of the Company i.e. www.bestagrolife.com and on the website(s) of Stock Exchanges i.e. www.bseindia.com For BESTAGROLIFE LIMITED

Place: New Delhi Date: September, 04 2024

CS & Compliance Officer



JAYASWAL NECO INDUSTRIES LIMITED

CIN-L28920MH1972PLC016154

Regd. Off.: F-8, MIDC Industrial Area, Hingna Road, Nagpur-440016 (MH) Tel No.: 07104 - 237471 / 72

Website: www.necoindia.com | E-mail: contact@necoindia.com

Notice of the 51th Annual General Meeting and E-Voting Instructions

The 51" Annual General Meeting ("AGM") of Jayaswal Neco Industries Limited ("the Company") will be held on Saturday, 28" September, 2024 at 12:30 P.M. through Video Conferencing ("VC") or Other Audio-Visual Means ("OAVM"), to transact the Businesses as set out in the Notice dated 14" August, 2024 convening the AGM.

Ministry of Corporate Affairs ("MCA") has vide its Circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and subsequent circular issued in this regard latest being 25" September, 2023 (hereinafter referred to as "MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by SEBI have permitted the holding of AGM through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with Section 101 of the Companies Act, 2013 read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and MCA Circulars, Notice of the 51" AGM and the Annual Report for the Financial Year 2023-24 are being sent in electronic mode to Shareholders whose e-mail addresses are registered with Link Intime India Pvt. Ltd. (RTA) / Depository Participant(s) on 30" August, 2024.

Shareholders who have not registered their e-mail address and in consequence to whom the Notice of AGM and Annual Report could not be serviced, may provide their email address and mobile number at the e-mail ID of the Company: contact@necoindia.com and may request the soft copy of the same. Notice convening the 51° AGM and the Annual Report for the Financial Year 2023-24 are available on the website of the Company

www.necoindia.com and can be accessed at the following links:-Notice of 51" AGM: https://www.necoindia.com/pdf/investor/annual-report/Notice%20convening%2051st%20Annual%20 General%20Meeting%20HR.pdf

Annual Report for the FY 2023-24: https://www.necoindia.com/pdf/investor/annual-report/51st%20Annual%20Report%20for %20the%20year%20ended%2031st%20March,%202024_HR.pdf

The same is also available on the website of National Securities Depository Limited ("NSDL") www.evoting.nsdl.com, BSE Limited

www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com. The said documents will also be available for inspection at the Registered office of the Company during its Business hours. Book Closure: Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and

Company will remain closed from Sunday, the 22" September, 2024 to Saturday, the 28" September, 2024 (both days inclusive) for the purpose of forthcoming AGM. E-voting: Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of Listing Regulations, the Members have been provided the facility

Administration) Rules, 2014 and Regulation 42 of Listing Regulations, the Register of Members and Share Transfer Books of the

of "remote e-voting" (i.e. e-voting from a place other than venue of AGM) to enable them to cast their vote by electronic means on all the resolutions as set out in the said Notice of AGM. In accordance with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Company has fixed

Saturday, 21" September, 2024 as the "cut-off date" to determine the eligibility of Members to vote by electronic means. A person whose name is recorded in the Register of Members of the Company or in the Statement of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, i.e. Saturday, 21" September, 2024, only shall be entitled to avail the facility of remote e-

The particulars pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules made thereunder are given herein below for the information of the Members:

Date of completion of dispatch of the Notice of AGM: Wednesday, 4th September, 2024.

Date: 4" September, 202 nancial exp. epapr.in

- ii) Date & time of commencement of remote e-voting through electronic means: Wednesday, 25" September, 2024 at 9:00 A.M.
- Date and time of end of remote e-voting through electronic means: Friday, 27" September, 2024 at 5:00 P.M.
- iv) For e-voting instructions, Members may go through the instructions contained in Note No. 14 of the Notice convening the AGM and in case of any gueries/grievances with regard to e-voting, member(s) may refer to the 'FAQs' available at www.evoting.nsdl.com or call on: 022-48867000 or send a request to Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL at email ID

Members will be provided with a facility to attend the AGM only through VC/OAVM through the NSDL e-Voting system. The instructions for joining the AGM are provided in the Notice of AGM. The attendance of the Members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. Members may note that: a) The remote e-voting facility shall be disabled by NSDL beyond 5:00 P.M. on 27" September, 2024 and

once the votes on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) The Company is also providing the e-voting facility during the AGM to those Members who will be present in the AGM through VC / OAVM and have not cast their vote through remote e-voting during the e-voting window; c) The Members may participate in the AGM even after exercising their right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting. Those persons who have acquired shares and have become Members of the Company after the dispatch of notice of the AGM by the

Company and whose names appear in the Register of Members of the Company or in the Statement of Beneficial Ownerships maintained by the Depositories as on the cut-off date, i.e. 21" September, 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdf.co.in and can view the Notice convening the AGM on the website of the Company www.necoindia.com, website of National Securities Depository Limited (NSDL) www.evoting.nsdl.com, BSE Limited www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com. Members can exercise their voting rights through remote e-voting by following the procedure as mentioned in the said Notice under e-voting instructions. For Jayaswal Neco Industries Limited

Ashish Srivastava

(Company Secretary and Compliance Officer) Membership No:- A20141

POST OFFER ADVERTISEMENT TO THE EQUITY SHAREHOLDERS OF **INERTIA STEEL LIMITED** ("INERTIA"/ "ISL" / "TARGET COMPANY"/ "TC")

(Corporate Identification No. L51900MH1984PLC033082) Registered Office: Shop No 155 Second Floor, Raghuleela Mall, Borsa Pada Road, Poiser Borivali West, Kandivali West, Mumbal, Maharashtra, India, 400067; Phone No.: +91-7030595007; Email id: contact@inertiasteel.com; Website: www.inertiasteel.com

Open offer for acquisition of 31,14,488 Equity Shares of Rs. 10/- each representing 26.00 % of the existing equity and voting share capital of the Target Company by Mr. Karbhari Pandurang Dhatrak (Acquirer-1), Mrs. Jayashree Karbhari Dhatrak (Acquirer-2) and Mr. Chetan Karbhari Dhatrak (Acquirer-3) (Acquirer-1, Acquirer-2 and Acquirer-3 hereinafter collectively referred to as the "Acquirers"). This Post offer Advertisement is being issued by Navigant Corporate Advisors Limited, The

Manager to the offer, on behalf of the Acquirers, in connection with the offer made by the Acquirers in compliance with regulation 18 (12) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulation, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulation, 2011").

The Detailed public statement ("DPS") pursuant to the Public Announcement ("PA") made by the Acquirers has appeared in Financial Express - English Daily (all editions); Jansatta Hindi Daily (all editions); Mumbai Lakshadeep - Marathi Daily (Mumbai edition) on 10^a June, 2024.

Proposed in the Offer

No.	raintuats.	Document		Actual	
1.1.	Offer Price	Rs. 18 per Equity Share		Rs.18 per Equity Share	
1.2.	Aggregate number of Shares tendered	31,14,488		Nit	
1.3.	Aggregate number of Shares accepted	31,14,488		Nil	
1.4.	Size of the offer (Numbers of shares multiplied by Offer price per share)	Rs. 5,60,60,784		Nil	
1.5.	Shareholding of the Acquirers before Preferential Issue and Public Announcement (No. & %)	Nii (0.00%)		Nii (0.00%)	
1.6.	Shares Acquired by way of Preferential Allotment Number % Fully Diluted Equity Share Capital	85,00,000 (70.96%)		85,00,000 (70.96%)	
1.7.	Shares Acquired by way of Open offer Number % Fully Diluted Equity Share Capital	31,14,488 (26.00%)		Nii (0.00%)	
1.8.	Shares Acquired after detailed Public Statement Number of Shares acquired Price of the shares acquired % of the shares acquired	Not Applicable		Not Applicable	
1.9.	Post offer Shareholding of Acquirers Number Krully Diluted Equity Share Capital	1,16,14,488 (96.96%)		85,00,000 (70.96%)	
1.10.	Pre and Post Offer Shareholding of Public Shareholders • Number • % Fully Diluted Equity Share Capital	Pre-Offer	Post Offer	Pre-Offer	Post offer
		2,32,803 (93.57%)*	3,64,312 (3.04%)	2,32,803 (93.57%)*	34,78,800 (29.04%)

*Computed as a %age of pre preferential equity and voting share capital of ISL The Acquirers accepts full responsibility for the information contained in this Post Offer Advertisement and also for the fulfillment of his obligations as laid down by SEBI

(SAST) Regulations, 2011.

A copy of this Post Offer Advertisement will be available on the website of SEBI. Capitalized terms used in this advertisement and not define herein, shall have same meaning assigned to them in the Letter of Offer dated 02.08.2024.

ISSUED BY MANAGER TO THE OFFER FOR AND ON BEHALF OF THE ACQUIRERS **NAVIGANT CORPORATE ADVISORS LIMITED** 804, Meadows, Sahar Plaza Complex, J B Nagar, Andheri Kuria Road, Andheri (East).

Mumbai-400059. Tel No. +91 22 4120 4837, Email id: navigant@navigantcorp.com Website: www.navigantcorp.com. SEBI Registration No: INM000012243 Contact person: Mr. Sarthak Vijlani

Place: Mumbai Date: September 04, 2024

Sr Particulars

Suresh Gondalia

Company Secretary

PEE CEE COSMA SOPE LTD.

CIN: L24241UP1986PLC008344

Regd. Office: Padamplaza, Hall No. H1-H2, First Floor, Plot No.5, Sector-16B Awas Vikas Sikandra Yojna, Agra-07 (U.P.), Tel.: 0562-2527331/32, 2650500, 3500550 Website: www.peeceecosma.com, E-mail: info@peeceecosma.com

PUBLIC NOTICE NOTICE FOR THE ATTENTION OF MEMBERS OF THE COMPANY 37TH ANNUAL GENERAL MEETING,

BOOK CLOSURE AND E VOTING INFORMATION Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Members

of the Company will be held on Monday, 30th September, 2024 at 3:00 PM at HOTEL P.L. PALACE, SANJAY PLACE, AGRA-282002 to transact the business as mentioned in the notice convening the Meeting. In compliance with the relevant circulars, the Notice of AGM and the Annual Report

2023-2024 including the Financial Statements for the Financial Year 2023-24, along with the Director's Report, Auditor's Report and other documents required to be attached there to has been sent to those members whose email addresses are registered with the Company, or Depository Participants or Registrar and Share Transfer Agent. Physical copies of the Notice of 37th AGM and Annual Report has been sent to all other members at their registered address in the permitted mode. The Notice of the 37th AGM and Annual Report are also available on the Company's website www.peeceecosma.com and the website of the Stock Exchange i.e BSE Limited at Manner of Registering/updating e-mail addresses to receive the notice of AGM

alongwith the Annual Report and /or updating Bank Account Mandate for receipt Members holding shares in physical mode are requested to update their email

addresses by sending a request letter to the company at info@peeceecosma.com alongwith the Form ISR 1 mentioning the name, Folio no., Mobile no., email address and address of the shareholder, bank account details, cancelled cheque leaf, scanned copies of share certificate(s) (both sides), self-attested PAN card and self attested copy of any document (eg. Driving License, Election Identity Card, Passport, Aadhar Card) in support of the address of the Members holding shares in Dematerialised mode are requested to register/update

their email addresses, Mobile Numbers, Bank Account details for receipt of dividend, and/or other details with the relevant Depository Participants.

E Voting: Pursuant to Section 108 of the Companies Act 2013 and Rule 20 of The Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is pleased to provide e-voting facility to its Members enabling them to cast their vote for all the resolutions as set in the Annual General Meeting Notice. The Company has availed e-voting services as provided by National Securities Depository Limited (NSDL). Shri Debabrata Deb Nath, Company Secretary in whole-time Practice of M/s R&D Company Secretaries, Delhi, has been appointed as the Scrutinizer for conducting e-voting process in a fair and transparent manner. The e-voting period commences on Friday, 27th September, 2024 at 9:00 am IST and ends on Sunday, 29th September, 2024 at 5:00 pm IST. The e-voting module shall be disabled by NSDL, for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. The voting rights of Members shall be as per the Number of Equity shares held by them as on the cut-off date which is 23rd September, 2024. Information and instructions comprising manner of voting, including voting remotely by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email address has been provided in the notice of AGM. Any person, who becomes member of the company after sending the notice of the 37th AGM by email and holding shares as on the cut-off date i.e 23rd September 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However if a person is already registered with NSDL for remote e-voting, then existing user ID and password can be used for casting vote.

Members may note that (1) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (2). At the venue of AGM, voting shall be done through ballot papers ("Ballot Paper") and the Members attending AGM who have not casted their vote by Remote E-voting shall be entitled to cast their vote through Ballot Paper. Member may participate in the AGM even after exercising his right to vote through Remote E-voting but shall not be allowed to vote again at the venue of the AGM. If a Member casts votes through Remote E-voting and also at the AGM, then voting done through Remote E-voting shall prevail done at the AGM shall be treated as inv

Book Closure: Pursuant to the provision of section 91 of the Companies Act 2013 and ules made there under, and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Register of Members and Share Transfer book of the Company will remain closed from Saturday, 21st September 2024 to Monday, 30th September, 2024 (both days inclusive) for the purpose of Dividen and 37th Annual General Meeting to be held on Monday, 30th September, 2024. Dividend: Shareholders may note that the Board of Directors at their meeting held on

28th May 2024, has recommended a final dividend of Rs. 5/- per share (Rs. 3/- per share plus a Special Dividend of Rs. 2 per share aggregating to Rs. 5/- per share) . The Final dividend, subject to approval of shareholders, will be paid to the members whose names appear in the Register of members as on the cut off date i.e. Saturday, 21st September, 2024 through various online transfer modes to the shareholders who have updated their bank account details. As per SEBI circular, in case of non updation of PAN or Choice of nomination or contact details or Mobile no, and Email address or Bank Account details or Specimen signature in respect of Physical Folios, Dividend shall be paid ONLY through electronic mode w.e.f 1st April 2024 upon furnishing all the aforesaid details in entirety.

Manner of registering mandate of receiving dividend electronically: To avoid delay in receiving dividend, Members are requested to update their bank

details with their Depositories (where the shares are held in dematerialized mode) and with Company/RTA -Skyline Financial Services Ltd., (where the shares are held in physical mode) by sending scanned copy of signed request letter mentioning the name, folio no., bank account details, self attested copy of PAN card and a cancelled cheque leaf with pre-printed name of the member (first shareholder) of the Company through email oninfo@skylinerta.com or info@peeceecosma.com Shareholders may note that the Income Tax Act, 1961 (ACT), as amended by the Finance Act, 2020, mandates that dividend paid or distributed by a company after 1st April, 2020 shall be taxable in the hands of the shareholders. The Company shall therefore be required to deduct Tax at Source (TDS) at the time of making of the final dividend. In order to enable us to determine the applicable TDS rates, shareholders are requested to submit the documents in accordance with the provisions of the Act by 20th September 2024. The detailed tax rates and documents required for availing the applicable tax rates are provided in the notice of the A.G.M.

Shareholders holding shares in the physical form are required to convert their holding in DEMAT form as transfer of shares in physical form has been

The entry to the meeting venue will be regulated by Attendance Slips, which have been sent along with Annual Report to the Members. Members are requested to submit a duly filled in Attendance Slip at the registration counter to attend the AGM.

Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager or Ms. Soni Singh, Asst. Manager, National Securities Depository Limited, Trade World: 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013, at evoting@nsdl.co.in or pallavid@nsdl.co.in or SoniS@nsdl.co.in or at telephone nos.:- +91 22 24994545, +91 22 24994559, who

will also address the grievances connected with the voting by electronic means.

n case of any queries related to E-voting, you may refer the Frequently Asked

For & on behalf of the Board PEE CEE COSMA SOPE LIMITED MAYANK JAIN

(Executive Chairman) DIN: 00112947

PLACE : AGRA DATED: 04.09.2024

મુંબઈ એરપોર્ટ પર

AI એક્સપ્રેસ કાઉન્ટર સ્ટાફ પર મહિલા પેસેન્જરે હમલો



પ્રવક્તાએ એક્સપ્રેસના મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "૧ સપ્ટેમ્બરના રોજ, એક મહિલા પેસેન્જરે મુંબઈ એરપોર્ટ પર અમારા ગ્રાઉન્ડ

મહિલા મુસાફરે મહિલા સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ જોઈને સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ પછી, ડ્યુટી મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઓપરેશન પાર્ટનરના સ્ટાફ મહિલાને પોલીસને હવાલે કરી.

ફન્ડના અભાવે

ચેરીટીનું કામઅટકી

ગયું હતું ત્યારે

અનંત અંબાણીએ

મંડળને સારો એવો

સપોર્ટ કર્યો હતો.

ફાઉન્ડેશને એ

સમયે મંડળને ૨૪

ડાયાલીસીસ

મંબઇના વિખ્યાત 'લાલબાગ ચા રાજા' ગણેશોત્સવ દરમ્યાન જે પૈંણે

મંબઇઃ વર્ષોથી લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ડોનેશન આવે છે એમાંથી આખા સાથે જોડાયેલા અનંત અંબાણીને વર્ષ દરમ્યાન મંડળ ચેરીટીનું કામ મુંબઇના આ નંબર વન ગણેશોત્સવ કરે છે. જો કે લોકડાઉનના સમયે

મંડળે ઓનરરી મેમ્બર બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલી મંડળની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંડ ળની

એન્યુઅલ જનરલ મીટીંગમાં આ બાબતનો પ્રસ્તાવ મશીન આપ્યા હતા તેમજ મંડળની મુકવામાં આવ્યો હતો જેને રુગ્ણ સહાય નિધિ યોજનામાં પણ સર્વાનુમતે અપ્રૂવ કરવામાં આવ્યો અનંત અંબાણીએ મદદ કરી હતી. હતો. મંડળના એક સભ્યે કહ્યું હતું દર વર્ષે અંબાણી પરિવાર કે એજીએમમાં લેવાયેલા નિર્ણય લાલબાગ ચા રાજાના દરબારમાં મુજબ કમિટિએ અનંત અંબાણીને આવતો હોય છે. ગયા વર્ષે તો ઓનરરી મેમ્મબરશીપ આપવાના લાલબાગ ચા રાજાના મંડળની નિર્ણય પર મંજુરીની મહોર મારી આસપાસ અનંત અંબાણીના દીધી છે. દર વર્ષે નજરલ બોર્ડની નામના બેનર્સ પણ લગાવવામાં મંજુરી સાથે આ મેમ્બરશીપની આવ્યા હતા. મુદત વધારી શકાશે.

કર્ણાટકમાં મચ્છરનું પ્રજનન રોકવા સહિતના ઉપાયો કરજિયાતઃ નિયમ ભંગ બદલ ભારે દંડ

બેંગ્લુરૂ તા.૪ કર્ણાટકમાં વધતા જતા ડેંગ્યુના કેસના કારણે સરકારે ડેંગ્યુને મહામારી જાહેર કરી છે. ડેંગ્યુના કહેરના કારણે સિધ્ધા રમૈયા સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. આ ઉપરાંત મચ્છરોની ઉત્પત્તિ-પ્રજનન રોકવામાં નિષ્ફળ જનાર લોકોને દંડ ફટકારવાના નિર્દેશ

સરકારે આપ્યા છે.

સરકારે કર્ણાટક મહામારી રોગ વિનિયમન ૨૦૨૦માં સંશોધન પણ રજૂ કર્યુ છે. જેમાં લોકોને વેકટરજનિત રોગના પ્રસારને રોકવા વધુ જવાબદાર થવાનો આદેશ આપ્યો છે. જે લોકો નિયમનું પાલન કરવામાં અને મચ્છરોના પ્રજનન રોકવામાં વિફળ રહે છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

હિમાચલમાં પક્ષપલ્ટો કરનાર ધારાસભ્ય પેન્શન ગુમાવશે

દેશમાં ધારાસભ્યો અને સાંસદોના પક્ષપલ્ટા સતત વધી રહ્યા છે. તે સમયે હિમાચલ સરકારે એક મહત્વના નિર્ણયમાં પક્ષપલ્ટો કરનાર ધારાસભ્યોને પેન્શન નહીં મળે તેવો કાનુન વિધાનસભામાં પસાર કરાવતા રાજ્યમાં રાજકીય રીતે અસ્થીરતા સામે એક વિઘ્ન ઉભું કરવા પ્રયાસ કર્યો છે. હાલમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કરીને ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ વિધાનસભામાં ધારાસભ્યોના પેન્શન અને ભથ્થા સુધારા ખરડો રજુ કર્યો હતો અને તેના પર ચર્ચા બાદ મંજુરી મળશે. જો કે રાજ્યપાલ આ ખરડો મંજુર કરે તો જ તે કાનુન બનશે. રાજ્યમાં કોંગ્રેસના ૪૦ અને ભાજપના ૨૮ ધારાસભ્યો છે. લોક્સભા ચૂંટણી અગાઉ અહીં કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા ભાજપે પ્રયાસ કર્યા છે પણ તે નિષ્ફળ નિવડ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે પક્ષપલ્ટાના કારણે વારંવાર રાજકીય અસ્થિરતા સર્જાઇ છે અને ધારાસભ્યો પોતાના લાભ માટે પક્ષપલ્ટો કરે છે.

મુંબઈ એરપોર્ટ પર એર હતું ." આ પછી મહિલા હતી.એર ઈન્ડિયા એક્સપ્રેસના ઈન્ડિયા એક્સપ્રેસ (એઆઈ મુસાફરને પોલીસને હવાલે પ્રવક્તાએ મંગળવારે એક એક્સપ્રેસ) કાઉન્ટર પર એક કરવામાં આવી હતી. મુંબઈ નિવેદનમાં જણાવ્યું હતું કે, "૧ મહિલા પેસેન્જરે મહિલા સ્ટાફ એરપોર્ટ પર એર ઈન્ડિયા સપ્ટેમ્બરના રોજ, એક મહિલા

એક મહિલા મુસાફરે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન પાર્ટનરના સ્ટાફ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું

પાર્ટનરના સ્ટાફ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું." ડ્યુટી તરત

મે ને જરે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ મહિલા પેસેન્જરને પોલીસને હવાલે કરવામાં આવી.તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા સ્પાઈસજેટ એરલાઈન્સની એક મહિલા કર્મચારીએ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સુરક્ષા પર તૈનાત સીઆઈએસએફ જવાનને થપ્પડ મારી હતી.

CISF જવાને કહ્યું કે એરલાઇનની મહિલા સ્ટાફ જ્યારે તલાશી લીધા વિના વાહનના ગેટમાં બળજબરીથી પ્રવેશવાની આવ્યો અને સીઆઈ ગિરિરાજ પ્રસાદ પર હાથ ઉપાડ્યો.આ પછી પીડિત સીઆઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી. ત્યારબાદ પોલીસે આરોપી મહિલા કર્મચારી અનુરાધા રાનીને

VEHICLE FOR SALE ASHOK LEYLAND LTD. Ashok Leyland 1618 1c Cabin and Chassis-2019 Reg.No.: GJ-01 HT5482 INDUSIND BANK 105_406 Arista Business Space, Near Pakwa Char Rasta, Bodakdev. Ahmedabad - 380054



9879624100



USHANTI COLOUR CHEM LIMITED CIN: L24231GJ1993PLC019444 Registered Office: 88/8, GIDC Phase I, Vatva, Ahmedabad - 382445, Gujarat, India. Tel. No.: 079-25833315/94903 Email Id: csucl@ushanti.com,Website: www.ushanti.com

NOTICE OF THE 31st ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 31" Annual General Meeting (AGM) of the Members o Ushanti Colour Chem Limited ("the Company") will be held on Saturday, 28th September, 2024 at 11:00 AM IST at registered office of the Company situated at 88/8, GIDC, Phase l, Vatva, Ahmedabad-382445, Gujarat, India in physical mode to transact the businesse: as set out in the Notice of the 31st AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('Act') & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable Circulars on the matter issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the businesses as mentioned in the

Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretaria Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEB Circular, the Notice of 31st AGM along with the Annual Report 2023-24 have been sent or Wednesday, 4th September 2024 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories Members are hereby informed that the said AGM Notice and Annual Report 2023-24 are also available on the Company's website www.ushanti.com website of the Stock Exchange i.e. NSE Limited (SME Emerge) i.e. www.nseindia.com and on the website o Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cas their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of Ballot Voting to vote at the Venue of AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with CDSI to provide remote e-voting. A person whose name appears on the Register of Members Beneficial Owners as on the cut-off date i.e. Saturday, 21st September 2024 shall only be entitled to avail of the remote e-voting facility during the AGM and also Ballot Voting at the venue of AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to

The remote e-voting period will commence on Wednesday, 25th September 2024 (09:00 AM IST) and will end on Friday, 27th September 2024 (05:00 PM IST). During this period, the member(s) of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by CDSL after 05.00 P.M. IST on Friday, 27th September 2024 (05:00 PM IST). Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Saturday, 21" September 2024. Detailed instructions relating to remote e-voting and Ballot Voting at AGM are provided in the Notes forming part of the 31" AGM Notice.

Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by email and holding shares as on Saturday, 21st September 2024, may refer to the AGM Notice and obtain the login ID and password from the Company by sending a request at csucl@ushanti.com. Members whose email id is not registered, may refer to 'Process for those shareholders whose email addresses are not registered with the "Depositories/Company/RTA for obtaining login credentials for e-voting' as detailed in 31

In case of any queries or issues regarding remote e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Manager, CDSL A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai – 400013 at e-mail: helpdesk.evoting@cdslindia.com, Tel

Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Sunday, 22" September 2024 to Saturday, 28th September 2024 (both days inclusive) for the purpose For Ushanti Colour Chem Limited

Date: 05th September 2024 Minku Shantilal Gandhi Joint Managing Director - DIN - 00118617

Place : Ahmedabad



દેશના ઉત્તર પૂર્વના રાજ્યોમાં મેઘ કહેર થમવાનું નામ નથી લેતો નાગાલેન્ડમાં ભારે વરસાદના કારણે યુપોકેદીમાં જીલ્લામાં કોહિયા અને દિયાપુરને જોડતા નેશનલ હાઇવે પર થયેલા ભૂસ્ખલનમાં ૩ લોકોના મોત થયા હતા ભુસ્ખનના કારણે હાઇવેનો કેટલોક ભાગ તેમજ મકાનો ક્ષતિગ્રસ્ત થયેલા નજરે પડે છે.

તા.૯ના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક ટેક્સ અને સેસ પર વિચારણા થશે

આગામી તા.૯ના રોજ જીએસટી કાઉન્સીલની મળનારી બેઠકમાં એક તરફ

રાજ્યને જે વળતર ચૂકવાય છે તે સંદર્ભમાં અમારા ગ્રાઉન્ડ ઓ પરેશન નિર્ણય લેવાશે અને માનવામાં આવે છે કે કમ્પનસેસન વધુ એક વર્ષ ચાલુ રહેશે અને જો તે રદ કરવી હોય તો તેના બદલે ટેક્સ કે અન્ય કોઇ સેસમાં વધારો કરવામાં આવશે. સીઆઈએસએફને જાણ કરી અને નાણાં મંત્રી નિર્મલા સિતારામનના અધ્યક્ષ પદ હેઠળ મળનારી આ બેઠક કેટલાક કેન્દ્ર સરકારે રાજ્યને જીએસટી વળતર ઉત્પાદનો પરના જીએસટી અંગે પણ વિચારણા થશે આ ઉપરાંત વિદેશી ઉભી કરી છે તેમાં હાલ ગ્ર.૧.૨૫ લાખ

આવી છે તેમાં તેમને રાહત અંગે નિર્ણય

કુલ ૧૦ વિદેશી એરલાયન્સોને આ પ્રકારે નોટીસ આપી છે. આ ઉપરાંત કાઉન્સીલની બેઠકમાં કાર અને ટુ-વ્હીલરની સીટ પરના જીએસટી કે જે હાલ અડધા ટકા છે તે વધારીને ૨૮ ટકા સધી લઇ જવાય તો તેવી શક્યતા નકારાતી નથી. ચુકવવા જે રૂા.૧.૫૯ લાખ કરોડની લોન

Kiri Industries Limited

Future Full of Colours

(CIN-L24231GJ1998PLC034094) રજીસ્ટર્ડ ઓફીસઃ ૭મો માળ, હસુભાઈ ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦ સંપર્ક નં.: (પી) +૯૧ ૭૯ - ૨૬૫૭૪૪૩૭૧/૭૨/૭૩, ફેક્સ: +૯૧ ૭૯ - ૨૬૫૭૪૩૭૪ ઈમેઈલ આઈડી: info@kiriindustries.com; વેબસાઇટ: www.kiriindusti

૨૬મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની ના પાડી ત્યારે તેઓ ગુસ્સે થઈ 🛮 ૨૬મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭, ગયા. આ પછી તે ઉતાવળમાં 📗 ૨૦૨૪ના રોજસવારે ૧૧:૦૦વાગે, કંપનીધારા, ૨૦૧૩ની જોગવાઈના પાલન અર્થે અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)ના સામાન્ય પરિપત્ર ક્રમાંક ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/ ૨૦૨૧, ૨૧/૨૦૨૧, ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તથા સેબી પરિપત્ર ક્રમાંક SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/ HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/ 2022/62, SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/4 અને SEBI/HO/ CFD/CFD-POD2/P/CIR/2023/167 (હવે પછી સંયુક્ત રીતે પરિપત્રો તરીકે ઉલ્લેખ થશે) સાથે વંચાણે લેવામાં આવતા ધ સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્રસ) રેગ્યુલેશન, ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન)નું અનુપાલન કરતાં વીડિયો કોન્ફરન્સ (V/C)ની સુવિધા મારફત એજીએમની નોટીસમાં જણાવેલા કામકાજ કરવા માટે યોજવામાં

ઉપરોક્ત પરીપત્રો અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેના વાર્ષિક અહેવાલની સાથે એજીએમની નોટીસ ઈલેક્ટ્રોનિક મોડ મારફત જે શેરધારકોના ઈમેઈલ એડ્રેસ ઓગસ્ટ ૩૦, ૨૦૨૪, શુક્રવારના રોજ કંપની/ડીપોઝીટરી પાસે નોંધાયેલ હશે તેઓને જિ સપ્ટેમ્બર ૦૪, ૨૦૨૪ના રોજ મોકલી આપવામાં આવેલ છે. ર૬મી એજીએમની નોટીસ સાથે વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.kiriindustries.com,</u> સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ <u>www.bseindia.com</u> અને www.nseindia.com, તથા સેંટ્રલ ડીપોઝીટરી સર્વિસીસ ઈન્ડિયા લીમીટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ <u>www.evotingindia.com</u> પર પણ ઉપલબ્ધ છે.

ધ કંપનીઝ (મેનેજમેંટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ સાથે વંચાણે લેવામાં આવતા કંપની ધારાની કલમ ૯૧ અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૪૨ના અનુસંધાને, કંપનીના સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બૂક એજીએમના હેતુસર શનિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૪થી શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૪ (બંને દિવસો સિમાવિષ્ટ)સુધી બંધ રહેશે અને રીમોટ ઇ-વોટિંગ અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ મારફત મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટે કટ-ઑફ તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૪ છે.

કંપની ધારાની કલમ ૧૦૮ અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમો અનુસાર, ફક્ત ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન મારફત જ સર્વ કામકાજ કરવામાં આવશે. કટ-ઑફ તારીખે શેર ધારણ કરનાર સભ્યો માટે રીમોટ ઇ-વોટિંગ નો પ્રારંભ મંગળવાર, સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૪ના રોજ સવારે ૯-૦૦ ક. (ભારતીય સમય)એ થશે અને ગુર્વાર,સપ્ટેમ્બર, ૨૬, ૨૦૨૪ના રોજ સાંજના ૫-૦૦ ક. (ભારતીય સમય)એ સમાપ્ત થશે. ઉપરોક્ત તારીખ અને સમય પછી રીમોટ ઇ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં. એજીએમ દરમિયાન ઇ-વોટિંગ માટેની સચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે. રીમોટ ઇ-વોટિંગ મારફત મતાધિકારનો ઉપયોગ કરનાર સભ્યો એજીએમમાં ઉપસ્થિત રહી શકશે તથા ભાગ લઈ શકશે પરંતુ એજીએમ દરમિયાન ફરી મત આપી શકશે નહીં. નોટીસ મોકલવામાં આવ્યા પછી જેમને શેર પ્રાપ્ત કરેલ છે અને કટ-ઑફ તારીખે શેર ધારણ કરેલ છે તેવી વ્યક્તિઓ helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગ ઇન વિગતો પ્રાપ્ત કરીને તેઓનો મત આપી શકશે. ઇ-વોટિંગ માટે અને લોગ ઇનની પદ્ધતિ માટે તથા વર્ચ્યુયલ સભામાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે.

ઇ-વોટિંગ પ્રક્રિયાનું ન્યાયી અને પારદર્શક રીતે નિરીક્ષણ કરવા માટે આર.ટી.બી.આર. એન્ડ એસોસીએટસ, પ્રેક્ટિસીંગ કંપની સેક્રેટરીસની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઇ-વોટિંગ સંબંધિત કોઈપણ પૂછપરછ માટે, શેરધારકો www.evotingindia.com પર હેલ્પ વિભાગમાં પ્રાપ્ય એફએક્ચૂ અને ઈવોટીંગ મેન્યુયલ જોઇ શકે છે અથવા શ્રી રાકેશ દળવી, સીનિયર મેનેજર, સીડીએસએલ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મીલ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩, ઇ-મેઈલઃ <u>helpdesk.evoting@cdslindia.com</u> પર સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ પર કોલ કરી શકે છે.

તારીખઃ સપ્ટેમ્બર ૦૫ , ૨૦૨૪ સ્થળઃ અમદાવાદ

કીરી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી સુરેશ ગોંડલીયા કંપની સેક્રેટરી

ઓનલાઇન કોર્સ કરવા માટે UGC -DEB પોર્ટલમાં નોંધણી કરવી ફરજીયાત

નવી દિલ્હી.તા.૪ એડમિશન પ્રક્રિયામાં પણ મહત્વનો DEV ID બનાવી શકાય છે.આ ઓનલાઈન અભ્યાસક્રમોમાં પ્રવેશ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રો . કુમારના પ્રક્રિયા શૈક્ષણિક સત્ર ૨૦૨૪ - ૨૫ લેતાં વિદ્યાર્થીઓએ પહેલાં UGC-DEB (ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો) પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. આ અંગે જારી કરાયેલી યુજસીની નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કેટલીક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અમાન્ય ઓપન અને

વિદ્યાર્થીઓને આ પ્રકારની ઓનલાઈન પોર્ટલ ડિગ્રીનો લાભ મળતો નથી.

જણાવ્યાં મુજબ, કોઈપણ વિદ્યાર્થી જે ઓનલાઈને અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે તે પહેલાં UGC-

આ સત્રમાં વધ્ વિકલ્પો મળશે

ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન કોર્સમાં વિદ્યાર્થીઓની નોંધણી કરી રહી છે. DEB (ડિસ્ટન્સ એજ્યકેશન બ્યરો) https:// deb.ugc.ac.in/ યુજસીના ચેરમેન પ્રો. એમ. studentDebId પર નોંધણી જગદીશ કહે છે કે જે રીતે રેગ્યુલર કરવાની રહેશે. નોંધણી પછી, વિદ્યાર્થીનું કોર્સમાં સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અપનાવવામાં DEB-ID તૈયાર થઈ જશે. એકેડેમિક આવે છે તે જ રીતે ઓનલાઈન કોર્સની બેંક ઓફ ક્રેડિટ ABC-ID માંથી

થી લાગુ કરવામાં આવશે અને ઓક્ટોબરથી શરૂ થતાં નવાં સત્રમાં પ્રવેશ લેનાર દરેક વિદ્યાર્થીએ આ યુનિક ID બનાવવાનું રહેશે. પ્રો . કુમારે કહ્યું ેક આ સાથે UGC પાસે દરેક સંસ્થામાં ઓનલાઈન અભ્યાસક્રમનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માહિતી હશે.

આ સત્રમાં યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સ માટે વધુ વિકલ્પો મળશે. ઓપન ઓનલાઈન કોર્સીસ પ્લેટફોર્મ સહિત IIT, IIM જેવી ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઓનલાઈન કોર્સીસનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

ઓમકાર ફાર્માકેમ લીમીટેડ

CIN: L93000GJ1995PLC025276 ઓફીસઃ ૩૧૦, વોલ સ્ટ્રીટ-૧, ગુજરાત કોલેજ ચારરસ્તા પાસે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, ગુજરાત Flor: +91 9711811163 E-mail: investors.opl@gmail.com Website: www.omkarpharmachem.co.in

રલ્મી એજીએમ, બુકક્લોઝર અને ઈ-વોટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીની ૨૯મી વાર્ષિક સાધારણ સભા **હોટલ ધ લોટસ પાર્ક, કોઠાવાલા ફ્લેટ સામે,** એલીસબ્રીજ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૬ ખાતે સોમવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજારો કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૧૦૧ અને ૧૩૬ની સાથે કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના રૂલ ૧૮ (ધ એક્ટ એન્ડ રુસ) ને અન્વયે એજાએમ ખાતે હાથ ધરવામાં આવનાર કામકાજ દર્શાવતી નોટિસ અને નાણાંકિય વર્ષ

૨૦૨૩–૨૪ના કંપનીના વાર્ષિક અહેવાલ કંપનીના શેર હોલ્ડરોને મોકલી આપેલ છે. વાર્ષિક અહેવાલ સાથે એજીએમની નોટીસ કંપનીની વેબસાઈટ www.omkarpharmachem.co.in અને સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ લીમીટેડ ની વેબસાઈટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮ અનુસાર તથા કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ અને સામાન્ય સભાનો સેકેટરીયલ સ્ટાન્ડર્ડ-૨ અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડીસક્લોઝર રીક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન ૨૦૧૫

(સેબી લીસ્ટીંગ રેગ્યુલેશન, ૨૦૧૫)ના નિયમન ૪૪ સમય-સમય પર સુધારા મુજબ કટઓફ તારીખ સોમવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શેર ધરાવતા સભ્યોને કંપની એજીએમની નોટીસમાં દર્શાવેલ તમામ ઠરાવો પર મત આપવા તેમના અધિકારનો ઉપયોગ કરવા માટેની સુવીધા પૂરી પાડે છે. કંપની એ ઈ-વોટીંગ સુવિધા પુરી પાડવા માટે અધિકૃત એજન્સી તરીકે સીટીએસએલ ને જોડેલ છે. સભ્યોએ નીચેની બાબતોની નોંધ લેવા ખાસ વિનંતી છે. ૧. ઈ–વોટિંગ શુક્રવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે શરૂ થઈને રવિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ

- સાંજે ૫:૦૦ કલાકે સમાપ્ત થશે, આમ ત્રણ દિવસ સુધી ઈ-વોટિંગ ખુલ્લું રહેશે. ત્યારબાદ સીડીએસએલ દ્વારા ઈ-વોટિંગ મોડ્યૂલ બંધ કરી દેવામાં આવશે. ઉક્ત તારીખ અને સમય બાદ રીમોટ ઈ–વોટિંગ કરવા દેવામાં આવશે નહીં.
- જે સભાસદોએ રીમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપ્યો નહીં હોય તેઓ એજાએમ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કંપની આ સંદર્ભમાં એજીએમના સ્થળે મતપત્રક (બેલોટ પેપર્સ)ની વ્યવસ્થા કરશે. રીમોટ ઇ-વોટિંગ દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ પણ સભાસદ સભામાં ભાગ લઈ શકશે, પરંતુ તેમને સભમાં
- કરીથી મત આપવા દેવામાં આવશે નહીં. કટ-ઓફ તારીખના રોજ સભાસદોના રજીસ્ટરમાં જેમનું નામ નોંધાચેલુ હશે એવી વ્યક્તિ રીમોટ ઈ-વોટિંગની સુવિધાનો લાભ લેવા તેમજ મતપત્રકો દ્વારા સભામાં મતદાન કરવા હક્કદાર છે. એજીએમ નોટીસ ઈશ્યૂ કર્યાબાદ જે કોઈ વ્યક્તિ કંપનીના મેમ્બર બનશે અને કટઓફ તારીખના રોજ શેર ધરાવતી હશે તેઓ એજીએમ ની નોટીસમાં પ્રી પાડવામાં આવેલ ઈ-વોટીંગ / રીમોટ ઈ-વોટીંગ મુજબની સુચના અને પ્રક્રિયા દ્વારા તેમનો મત આપી શકે છે.
- કપંનીએ ન્યાયીક અને પારદર્શક રીતે ઇ-વોટિંગની પ્રક્રિયા ચકાસવા માટે શ્રી મોલિક ભાવસાર એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેકેટરીની સ્કૂટીનાઈઝર તરીકે નિમણૂક કરી છે.

ઈ-વોટિંગને લગતી વિસ્તૃત સૂચના માટે સભાસદો વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં 'નોંધ' વિભાગનો સંદર્ભ લઈ શકે છે. ઈ-વોટિંગ પ્રોસીજરને લગતા કોઈ પ્રશ્નો કે મુદ્દાઓ હોય તો શેરધારકો www.evotingindia.com ના ડાઉનલોડ સેક્શન ખાતે ઉપલબ્ધ ફ્રીક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન (એફએક્યુએસ) અને શેરધારકો માટેના ઈ–વોટિંગ યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈ-મેઈલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૧ ૦૯૯૧૧ ઉપર શ્રી રાકેશ દલવી, સીનીયર મેનેજર, (સીડીએસએલ), એ-વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચર, મફતલાલ મિલ કંપાઉન્ડ્સ, એન.એમ. જોશી માર્ગ, લોઅ૨ પરેલ (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૧૩ અથવા કંપની સેકેટરી કમ કમ્પલાયન્સ ઓફિસ૨નો ઇ–મેઇલ investors.opl@gmail.com, ફોન નં. ૯૮૧૮૯૮૨૨૭, સરનામું: ૩૧૦, વોલ સ્ટ્રીટ-૧, ગુજરાત કોલેજ ચારરસ્તા, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, ગુજરાત ખાતે સંપર્ક કરી શકે છે.

એજીએમની નોટિસ કંપનીની વેબસાઇટ www.omkarpharmachem.co.in અને સીડીએસએલની વેબસાઇટ https:// www.evotingindia.com પર ઉપલબ્ધ છે.

આ ઉપરાંત સેબી (લિસ્ટીંગ ઓબલિગેશન એન્ડ ડીસ્કલોઝર્સ રીક્વાયરમેન્ટસ) રેગ્યૂલેશન ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૨ અને કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૯૧ અને તેના હેઠળ લાગુપડતા રૂલ્સના સંદર્ભમાં કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને કંપનીની શેર ટ્રાન્સફર બુક સોમવાર, 30 સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ચોજાનારી ૨૯મી એજીએમના હેવુસર શનીવાર, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુક્રવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બંને દિવસ સહિત) સુધી બંધ રહેશે.

તારીખ: ૦૪.૦૯.૨૦૨૪ ક્લળઃ અમદાવાદ

બોર્ડના આદેશ હારા ઓમકાર ફાર્માકેમ લિમિટેડ વતી, સહિ/-ભવાની શંકર ગોચલ (એમ.ડી.) ડીનઃ ૦૩૨૫૫૮૦૪ સરનામું: ઘર નં. ૧૫૫/૨, પહેલા માળે, ગલી નં. ૨, ગુરૂદ્ધારા પાસે, ગોવિંદપુરી, કલકાજી - ૧૧૦૦૧૯ દિલ્હી

એચએલઈ ગ્લાસકોટ લિમીટેડ

CIN No.: L26100GJ1991PLC016173

રજી. ઓફિસ : એચ.૧૦૬ - જી.આઈ.ડી.સી. વિટ્ઠલ ઉદ્યોગનગર, આણંદ, ગુજરાત - ૩૮૮૧૨૧. .

૩૩ મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") અને બુક ક્લોઝર તારીખ આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૩ મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") નોટીસમાં જણાવ્યા મુજબ વ્યવસાયનો વ્યવહાર કરવા માટે ગુરૂવાર તા. ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિકિયો કોન્ફરન્સિંગ ("VC")/અન્ય ઓકિયો વિઝ્યુઅલ

કોર્પોરેટ અર્કેસ મંત્રાલયે ("MCA") તેના પરિપત્ર નં ૦૯/૨૦૨૩, તા. ૨૫/૦૯/૨૦૨૩ જે બીજા પરિપત્રો, નં ૧૦/૨૦૨૨ તા. ૨૮/૧૨/૨૦૨૨, નં. ૦૨/૨૦૨૨ તા. ૦૫/૦૫/૨૦૨૨, ૨૧/૨૦૨૧ તા ૧૪/૧૨/૨૦૨૧, ૦૨/૨૦૨૧ તા.૧૩/૦૧/૨૦૨૧ અને ૨૦/૨૦૨૦ તા. ૦૫/૦૫/૨૦૨૦ સાથે સામાન્ય પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૦૮/૦૪/૨૦૨૦ તથા સામાન્ય પરિપત્ર નં ૧૭/૨૦૨૦ તા. ૧૩/૦૪/૨૦૨૦ ના સાતત્થમાં છે. તેમજ સેબી અને તેના સામાન્ય પરિપત્રો નં SEBI/H0/CFD/CFD-P0D-2/P/CIR/2023/167 તા. ૭મી ઓક્ટોબર ૨૦૨૩, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ તથા SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે ૨૦૨૦ દ્વારા સામાન્ય સભ્યોની એકજ સ્થળે શારીરિક કાજરી વિના VC/OAVM દ્વારા એજીએમ કરવાની મંજુરી આપેલ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ"), સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને કિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("સેબી લીસ્ટીંગ રેગ્યુલેશન્સ, ૨૦૧૫") અને MCA પરિપત્રોની જોગવાઇઓનું પાલન કરીને, કંપનીની એજીએમ VC/OAVM દ્વારા ચોજવામાં આવશે. એજીએમની કાર્ચવાદી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં હાથ ઘરવામાં આવી હોવાનું માનવામાં આવશે જે એજીએમના સ્થળ તરીકે ગણવામાં આવશે. VC/OAVM દ્વારા એજીએમમાં હાજરી આપનાર સભ્યોને કંપની અધિનિયમની ધારા ૧૦૩ અંતર્ગત કોરમની ગણતરીનાં દેતુ માટે માન્ય ગણવામાં આવશે. VC/OAVM દ્વારા યોજાનારી એજીએમમાં જોઠાવવા માટેની સૂચનાઓ એન્ટ્રેમની નોટિઝમાં ઉપલબ્દા છે.

લિન્ક ઇન ટાઇમ ઇન્કિયા પ્રાઇવેટ લીમીટેક (LIIPL) ની ઇ-વોર્ટિંગ સેવાઓ દ્વારા કંપની તેના સભ્યોને ઇ-વોર્ટિંગ સિસ્ટમ ("રિમોટ ઇ-વોર્ટિંગ") નો ઉપયોગ કરીને મતદાન કરવાની સુવિધા આપતા આનંદ અનુભવે છે. વધુમાં કંપની એજીએમ દરમ્યાન ઇ-વોર્ટિંગ સિસ્ટમ દ્વારા પોતાનો મત આપનારા સભ્યો પણ એજીએમમાં ભાગ લઈ શકે છે. પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા હક્કદાર રહેશે નહી. એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોર્ટિંગ અને ઇ–વોર્ટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવી છે.

રિમોટ ઇ–વોર્ટિગની અવધિ સોમવારતા ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ (IST) કલાકે શરૂ થશે અને બુધવારતા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે પઃ૦૦ કલાકે (IST) સમાપ્ત થશે. ગુરૂવાર તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ ની કટ ઓફ તારીખ પ્રમાણે શેર ઘરાવતા કંપનીના સભ્યો ઇ–વોર્ટિગ દ્વારા પોતાનો મત આપી શકે છે. કોઇપણ સભ્ય એજીએમની નોટીસ મોકલ્યા પછી કંપનીના શેર ખરીદીને કંપનીના સભ્ય બન્યા હોય અને ગુરૂવાર તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ શેર ધરાવતા હોય તેઓ vadodara@linkintime.co.in પર રિકવેસ્ટ મોકલી login id તથા પાસવર્ડ મેળવી શકે છે. રીમોટ ઇ–વોર્ટિંગ મોડ્યુલ બુધવાર તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના બરાબર પઃ૦૦ કલાકે લિન્ક ઇન ટાઇમ (LIIPL) દ્વારા વોર્ટિંગ માટે બંધ કરવામાં આવશે.

ગુરૂવાર, તા. ૧૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૪ (કટ ઓફ કેટ) ના રોજ જેઓ સભાસદ તરીકે રજિસ્ટર્ક ફરો તેઓ જ મત આપવા માટે ફક્કદાર રહેશે. ઉપરોક્ત MCA પરિપત્રો અને સેબીના પરિપત્રનું પાલન કરીને, વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ માટેના વાર્ષિક અઠેવાલ સાથે તે સભ્યોને જ ઇલેક્ટોનિક મોદ દ્વારા મોકલવામાં આવી રહેલ છે કે જેમના ઇમેઇલ સરનામાં કંપની /આરટીએ સાથે નોંધાયેલા છે. સભ્યો નોંધ લઇ શકે કે નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.hleglascoat.com, સ્ટોક એક્ષચેન્જ i.e BSE અને NSE ની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

સભાસદોની વોર્ટિંગ ની બાબતના કોઇપણ પ્રશ્નો/ખુલાસાઓ માટે Frequently Asked Questions (FAQs) અને ઇ–વોર્ટિંગ મેન્યુઅલ https://instavote.linkintime.co.in અથવા ટોલ ફ્રી નં. 022-49186000 પર સંપર્ક સાધવા વિનંતી છે. સભાસદ enotices@linkintime.co.in પર ઇ–મેઇલ કરીને પણ જાણકારી મેળવી શકે છે.

આથી સુચિત કરવામાં આવે છે કે સભાસદોનુ રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બૂક્સ શુકવાર તા. ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ થી ગુરૂવાર તા. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૨૪ (બંને દિવસ સહિત) બંધ રહેશે.

જે સભ્યો ઇલેક્ટ્રોનિક સ્વરૂપ માં શેર ધરાવતા હોય અને જે સભ્યો પોતાના ઇમેલ આઇકી, ટપાલ નું સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર, પરમેનેન્ટ એકાઉન્ટ નંબર, બેંક ખાતાની વિગતો અને નામાંકન નોધાયેલા નથી અથવા અપકેટ કરવા ઇચ્છતા હોય તેઓએ તેમના ડિપોઝિટરી પાર્ટીસિપેંટ (DP) સાથે ઉપરોક્ત વિગાતે નોંધાવવા/સંલગ્ન કરાવવા વિનંતી અને ફિઝિકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો, એ કંપની અથવા કંપનીના रिषर्ट्रार અने शेर ट्रान्सइर એજેંટ (RTA) એટલે કે લીંક ઇનટાઇમ ઇन्डिया प्राઇવેટ લિમિટેક, વडोहराने જરૂરી દસ્તાવેજો સાથે વ્યવસ્થિત હસ્તાક્ષરીત લાગુ પડતાં ઇન્વેસ્ટર સર્વિસ રિક્વેસ્ટ (ISR) ફોર્મ જમા કરવા વિનંતી કરવામાં આવે છે.

ઉપરોક્ત ઇન્વેસ્ટર સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ કંપનીની વેબસાઇટ www.hleglascoat.com પર અને RTA વેબસાઇટ https://:www.linkintime.co.in นะ ઉપલબ્ધ છે.

ไรใจระธ นะ ระ รนเส (TDS):

- ૧. નાણાં અધિનિયમ, ૨૦૨૦ દ્વારા સુધારેલ આવક વેરા કાયદા, ૧૯૬૧ ની શરતોમાં, કિવિકન્ક આવક શેરધારકો ના હાથમાં તા. ૦૧, એપ્રિલ, ૨૦૨૦ થી કરપાત્ર રહેશે અને કંપનીએ શેરધારકો ને ડિવિડન્ડની ચુકવણી નિર્ધારિત દરે કરની કપાત કર્યા બાદ કરવાની રહેશે.
- આવક વેરા ભરવાપાત્ર ન હોય તેવા સભ્યોએ, https://linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html ની લિંક પર સંબંધિત દસ્તાવેજો સાથે આ અંગેની જાણ તા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ અથવા એ પહેલા કરવાની રહેશે. સભાસદો એજીએમ, બુક કલોઝર, ઇ-વોર્ટિંગ અને ડિવિડેંડ પર કર કપાત અંગેની વિગતવાર સુચના માટે એજીએમની નોટિસ ધ્યાને લઇ શકે છે.

એય.એલ.ઈ. ગ્લાસકોટ લિર્મીટેડ सही/-

તારીખ: ૦૪.૦€.૨૦૨૪ અચલ એસ. ઠક્કર કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયંસ ઓફિસર સ્થળ : આણંદ

